https://archive.org/details/bk925/page/n0/mode/1up

2009-04-15 -Satpanth Hit Rakshak Mandal (925)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

Apr 08 2010 9:56AM ASHAPURI SAW MILL MODASA 91 2774 247741 p.1

અખિલ ભારતીય સતપંથ હિત - રક્ષક મંડળ

C/o. નેશનલ સ્ટોન ઈન્ડસ્ટ્રીજ
N.S.C. 101 સુપર મોલ સાયન્સ કોલેજ નીચે, ઈન્ફો સીટી.
ગાંધીનગર - ૦૭૯ - ૨૩૨૧૩૦૪૭

તા. ૧૫/૪/૦૯

પ્રમુખશ્રી,
શ્રી ઉમિયા માતાજી વાંઢાય ટ્રસ્ટ
વાંઢાય દેશલપર
ભૂજ.

વિષય :- આમંત્રણ પત્રિકા ન મળવા બાબત.

સપ્રેમ નમસ્કાર.

જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ કચ્છ વિભાગ દ્વારા શ્રી ઉમિયા માતાજી વાઢાંયમાં નવીન બંધાયેલ મંદિરનું **"પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ"** ખૂબ જ રંગે ચંગે અને ભાવભક્તિ પૂર્વક અને લાગણી સભર કાર્યક્રમોથી ઉજવાયો જે જાણી અનહદ આનંદ થયો.

પણ અફસોસ એ વાતનો છે કે આ કાર્યક્રમ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત થયેલ હોય અને ગુજરાત વિસ્તારના મોડાસા, બાયડ, કપડવંજ, વડાલી, ઈડર, ખેડબ્રહ્મા, જેવા અત્યંત અગત્યના વિસ્તારોમા વસતા તમાંમ સતપંથી ભાઈઓના કંપાઓમાં તેમજ વ્યક્તિગત રીતે એક પણ આમંત્રણ પત્રિકા મળેલ નથી.

સદર બાબતે જણાવવાનું કે આપ શ્રીએ અમોને આમંત્રણ પત્રિકા મોકલાવેલ છે કે કેમ ? જો મોકલાવેલ હોય તો કોની સાથે અને ક્યાં મોકલાવેલ હતી ? તે વિશે તપાસ કરી યોગ્ય ખુલાસો કરી જવાબ મોકલવા નમ્ર વિનંતી છે.

તા.ક. :- ઉપરોક્ત કાર્યક્રમ "મુખ્ય જમણ" ના દાતાશ્રી તરીકે "પ્રેરણા પીઠ પીરાણા" તેમજ નિષ્કલંકી ધામ નખત્રાણા હતા. તેમ છતાં અમને આમંત્રણ શા માટે નહિં ? આ બાબતે અમારી લાગણી ભારોભાર દુભાય છે અને ખૂબ મન દુખ થયુ છે.

નકલ રવાંના :-

(૧) શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા.
(૨) શ્રી પટેલ અરજણભાઈ શામજીભાઈ, મુ. આંસર
(૩) શ્રી પટેલ રતનસિંહભાઈ લાલજીભાઈ મુ. દુર્ગાપુર.

આપનો જિજ્ઞાસુ

પ્રમુખ / મંત્રી
અખિલ ભારતીય-સતપંથ હિત-રક્ષક મંડળ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
Page 1 of 1
email: mail@realpatidar.com
Authenticity of this letter cannot be confirmed. The letter is unsigned.

https://archive.org/details/bk925/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk925/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.20 12:07:45 +05'30'

Real Patidar
Unravel Truth

2009-04-15 -Satpanth Hit Rakshak Mandal (925)

---

(1)

realpatidar.com

અખિલ ભારતીય સતપંથ હિત - રક્ષક મંડળ

C/o. નેશનલ સ્ટોન ઈન્ડસ્ટ્રીઝ
N.S.C. 101 સુપર મોલ સાયન્સ કોલેજ નીચે, ઈન્ફો સીટી.
ગાંધીનગર - ૦૭૯ - ૨૩૨૧૩૦૪૭

તા. ૧૫/૪/૦૯

પ્રમુખશ્રી,
શ્રી ઉમિયા માતાજી વાંઢાય ટ્રસ્ટ
વાંઢાય દેશલપર
ભૂજ.

વિષય :- આમંત્રણ પત્રિકા ન મળવા બાબત.

સપ્રેમ નમસ્કાર.

જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ કચ્છ વિભાગ દ્વારા શ્રી ઉમિયા માતાજી વાઢાંયમાં નવીન બંધાયેલ મંદિરનું **"પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ"** ખૂબ જ રંગે ચંગે અને ભાવભક્તિ પૂર્વક અને લાગણી સભર કાર્યક્રમોથી ઉજવાયો જે જાણી અનહદ આનંદ થયો.

પણ અફસોસ એ વાતનો છે કે આ કાર્યક્રમ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત થયેલ હોય અને ગુજરાત વિસ્તારના મોડાસા, બાયડ, કપડવંજ, વડાલી, ઈડર, ખેડબ્રહ્મા, જેવા અંત્યંત અગત્યના વિસ્તારોમા વસતા તમાંમ સતપંથી ભાઈઓના કંપાઓમાં તેમજ વ્યક્તિગત રીતે એક પણ આમંત્રણ પત્રિકા મળેલ નથી.

સદર બાબતે જણાવવાનું કે આપ શ્રીએ અમોને આમંત્રણ પત્રિકા મોકલાવેલ છે કે કેમ ? જો મોકલાવેલ હોય તો કોની સાથે અને ક્યાં મોકલાવેલ હતી ? તે વિશે તપાસ કરી યોગ્ય ખુલાસો કરી જવાબ મોકલવા નમ્ર વિનંતી છે.

તા.ક. :- ઉપરોક્ત કાર્યક્રમ "મુખ્ય જમણ" ના દાતાશ્રી તરીકે "પ્રેરણા પીઠ પીરાણા" તેમજ નિષ્કલંકી ધામ નખત્રાણા હતા. તેમ છતાં અમને આમંત્રણ શા માટે નહિં ? આ બાબતે અમારી લાગણી ભારોભાર દુભાય છે અને ખૂબ મન દુખ થયુ છે.

નકલ રવાંના :-

(૧) શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા.
(૨) શ્રી પટેલ અરજાણભાઈ શામજીભાઈ, મુ. આંસર
(૩) શ્રી પટેલ રતનસિંહભાઈ લાલજીભાઈ મુ. દુર્ગાપુર.

આપનો વિશ્વાસુ

પ્રમુખ / મંત્રી
અખિલ ભારતીય-સતપંથ હિત-રક્ષક મંડળ

realpatidar.com